

# એવિડન્સ ફોર ઇક્વિલિટી નેશનલ સર્વે (EVENS) નિયમો અને શરતો

## 1. સામાન્ય સ્વીકૃતિ

એવિડન્સ ફોર ઇક્વિલિટી નેશનલ સર્વે (EVENS) પૂરો કરવાનું ચાલુ રાખીને તમે સ્વીકારો છો કે તમારે MORI અને માર્કેટ ઓપિનિયન રિસર્ચ ઇન્ટરનેશનલ લિમિટેડ (“Ipsos MORI” અથવા “અમે”) અને યુનિવર્સિટી ઓફ માન્યેસ્ટર દ્વારા સૂચિત કરાયેલ કોઈપણ ગોપનીયા નીતિની સાથે-સાથે આ નિયમો અને શરતોનું પાલન કરવાનું રહેશે. અમે આ નિયમો અને શરતોમાં સુધાર અથવા ફેરફાર કરવાનો અધિકાર સુરક્ષિત રાખીએ છીએ.

## 2. આ સર્વેમાં ભાગ લેવા માટે વપરાશકર્તાઓને £ 10 ગિફ્ટ વાઉચર (ત્યારબાદ 'પ્રમોશન' તરીકે ઓળખવામાં આવે છે) પ્રાપ્ત કરવા પાત્ર થવા માટેની આવશ્યકતાઓ:

- ઇન્સ્ટિટ્યુટ માટે પાત્ર થવા માટે તમારે મુખ્ય EVENS સંપૂર્ણપણે પૂરો કરવાનો રહેશે (જેમાં લગભગ 30 મિનિટ લાગશે). માત્ર નોંધણી સર્વે પૂરો કરવાથી (જે નક્કી કરશે કે તમે મુખ્ય સર્વે માટે પાત્ર છો કે કેમ અને જે લગભગ 5 મિનિટ ચાલશે) તમે ઇન્સ્ટિટ્યુટ મેળવવા માટે પાત્ર બનશો નહીં.
- તે 18 વર્ષ અથવા વધુ ઉંમરના ગ્રેટ બ્રિટનના નિવાસીઓ સુધી સીમિત છે.
- Ipsos MORI કોઈપણ કારણ આપ્યા વિના સર્વેમાં સહભાગિતા માટે ઇન્સ્ટિટ્યુટ પૂરું પાડવાનો ઇન્કાર કરવાનો અધિકાર સુરક્ષિત રાખે છે.
- સર્વેમાં ભાગ લેવો નિઃશુલ્ક છે અને તમારા માટે અંગત છે. તમે ઇન્સ્ટિટ્યુટ બીજા કોઈને હસ્તાંતરિત કરી શકશો નહીં.
- આ નિયમો અને શરતો હેઠળ તમે કોઈ ઇન્સ્ટિટ્યુટ મેળવવાને પાત્ર થશો નહીં જો:
  - તમે આ સર્વે પહેલાજ પૂરો કરી લીધો હોય. ડ્રપ્લીકેટ સર્વેનો સમાવેશ કરવામાં આવશે નહીં અને સર્વેમાં ભાગ લેનારાઓ કોઈ ઇન્સ્ટિટ્યુટ માટે પાત્ર થશે નહીં.
  - જો તમે અપ્રમાણિક અથવા ખોટો ડેટા પૂરો પાડશો, તો તમે કોઈ ઇન્સ્ટિટ્યુટ મેળવવાને પાત્ર થશો નહીં. આવું નિર્ધારણ માત્ર Ipsos MORIની એકમાત્ર અને સમગ્ર વિવેકબુદ્ધિ મુજબ કરવામાં આવશે.
- તમે EVENS સર્વે સહાયતા પેજ: [www.evenssurveyinfo.ipsos-mori.com](http://www.evenssurveyinfo.ipsos-mori.com) પર જઈને સર્વે સંબંધી ગોપનીયતા નીતિઓ જોઈ શકશો અને આ રિસર્ચ અને તમે પૂરો પાડો તે ડેટાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે તે વિશે માહિતી મેળવી શકશો.

## 3. જવાબદારી

- કાયદા દ્વારા અનુમત સીમા સુધી, Ipsos MORI આ નિયમો અને શરતો હેઠળ સર્વેમાં તમારી સહભાગિતા અથવા તમારા દ્વારા તે પૂરો કરવાના કારણે થયેલ અથવા તેમાંથી પરિણામેલ કોઈપણ નુકસાન, લાગત અથવા ખર્ચ (જેમાં પરોક્ષ, પરિણામિત અથવા સહગામી નુકસાન, ખર્ચ કે ક્ષતિનો સમાવેશ થાય છે), ને માટે જવાબદાર રહેશે નહીં.

## 4. ઇન્સ્ટિટ્યુટ

આ સર્વે માટેનો ઇન્સ્ટિટ્યુટ આ નિયમો અને શરતો અને માર્કેટ રિસર્ચ સોસાયટીના (MRS) ઇન્સ્ટિટ્યુટ આપવા સંબંધી વિનિયમો મુજબ આપવામાં આવે છે, જે વિશે વધુ વિગતો અહીં મેળવી શકાશે:

<https://www.mrs.org.uk/pdf/Regulations%20for%20Incentives%20and%20Prize%20Draws%20July%202015.pdf> ]

## 5. અન્ય વેબસાઇટની લિંક

સર્વે વેબસાઇટ બીજી વેબસાઇટ્સ અથવા ઓનલાઇન સંસાધનોને લિંક્સ પૂરી પાડી શકે છે. Ipsos નું આવી સાઇટો અને સંસાધનો પર કોઈ નિયંત્રણ ન હોવાથી, Ipsos આ સાઇટો અથવા સંસાધનો માટે કોઈ જવાબદારી કે કર્તવ્ય સ્વીકારી શકતા નથી. Ipsos આવી બાહ્ય સાઇટો કે સંસાધનોની ઉપલબ્ધતાની ગેરંટી આપી શકતા નથી, તેમજ Ipsos MORI આવી સાઇટ અથવા સંસાધનો પર ઉપલબ્ધ કોઈપણ સામગ્રી, જાહેરાત, પ્રોડક્ટ, કુદીઝ, વેબસાઇટ ટેક્સ અથવા અન્ય સામગ્રીનું સમર્થન કરતા નથી. તેમ સ્વીકારી છે અને સમંત થાવ છે કે આ નિયમો અને શરતોની શરત ૩ ને આધીન Ipsos MORI આવી કોઈપણ સામગ્રી પર વિશ્વાસ રાખવા, આવી સાઇટ અથવા સંસાધન પર અથવા મારફતે ઉપલબ્ધ સામગ્રી, માલ અથવા સેવાઓનો ઉપયોગ કરવા સંબંધે અથવા તેના કારણે થયેલ કોઈપણ પ્રત્યક્ષ અથવા પરોક્ષ નુકસાન અથવા હાનિ માટે જવાબદાર અથવા ઉત્તરદાયી થશે નહીં.

## 6. લાગુ કાયદો અને ન્યાયક્ષેત્ર

આ નિયમો અને શરતો ઈંગ્લેન્ડ અને વેલ્સના કાયદા દ્વારા સંચાલિત છે અને ફક્ત ઈંગ્લેન્ડ અને વેલ્સના ન્યાયાલયોના ન્યાયક્ષેત્રને આધીન છે.

## 7. Ipsos MORI સંપર્ક

તમે evenssurvey@Ipsos-MORI.com પર ઈમેલ મોકલીને Ipsos MORI ટીમનો સંપર્ક કરી શકશો.

વૈકલ્પિક રીતે, તમે આ સરનામે પત્ર લખીને પણ તેમનો સંપર્ક કરી શકો છો:

EVENS Survey (20-089809-01)  
Ipsos MORI  
3 Thomas More Square  
London E1W 1YW